

જૈન કવિ શ્રી હેમરતનવિરચિત વીરગાથા :  
ગોરા-ભાડલ-પદમની-કથા-ચૌપદ્ધ  
[સંક્ષિપ્ત પરિચય]

મુનિ શ્રી જિનવિજયજી, પુરાતત્ત્વાચાર્ય

જૈન સંપ્રદાયનો લાગીર્ણ પ્રાચીન સમયમાં મુખ્યત્વે 'યતિ'ના નામથી અસ્થિક હતો. એનું ખીજું  
નામ 'મુનિ' પણ હતું; પરંતુ જૈનેતર વર્ગ મોટે ભાગે જૈન ત્યાગીર્ણને 'યતિ' નામથી  
ઓળખતો હતો.

જૈન યતિવર્ગનો સાહિત્યિક અને સાંસ્કૃતિક ઝાળો

પંજાબ, હિન્દુસ્થાન, મારવાડ-મેવાડ વગેરે આપું રાજસ્થાન, માલવા, મધ્ય પ્રદેશ, ગુજરાત,  
સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત હવે પાકિસ્તાનમાં ગયેકા હેદરાબાદ સાથેના સિંધ પ્રદેશ સહિત ભારતના  
સમસ્ત પશ્ચિમ ભાગના મધ્યકાલીન ધતિહાસનું અવલોકન કરતાં માલૂમ પડે છે કે એ યુગમાં જૈન  
યતિવર્ગે દેશના સાહિત્યિક અને સાંસ્કૃતિક વિકાસમાં ધંણો મોટો ઝાળો આપ્યો છે.

જૈન ધર્મે ઉદ્ધોધિક જીવન-આર્થિક પ્રમાણે આ યતિઓ, ધર્મા અને સમજખુપૂર્વક, સાંસારિક  
જીવનનો ત્યાગ કરીને વિરક્ત જીવનનું અનુસરણ કરતા હતા. અને અહિસાસાધક તપ, સંયમ, અલાર્ય  
અને અપરિયાહ વતનું પાદન કરવું એ એમના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. આ લક્ષ્ય અનુસાર તેઓ  
પોતાના જીવનને એક સાધકના ઇપમાં ફેરવવા માટે હમેશાં યથાશક્તિ પ્રયત્નરીલ રહેતા હતા, અને  
પોતાના જીવન અને ઉપરદેશ દ્વારા, એમના સંપર્કમાં આવતા જનસમૂહને આર્થિક સુસંસ્કારી જીવન  
જીવવાની પ્રેરણું આપતા રહેતા હતા. આ યતિજીનો કોઈ પણ રૂથાને સ્થિરવાસ કરવાને બદલે જુદા જુદા  
પ્રદેશોમાં નિરંતર પરિભ્રમાણ કરતા રહેતા હતા, અને ડેવળ સામાન્ય બિક્ષા દ્વારા પોતાની કાયાને ટકાણી  
રાખતા હતા. તેઓ ન કોઈની પાસે ધન-ધાન્યની યાચના કરતા કે ન કોઈની પાસેથી બેટ-સોગાત-પૂજને  
ધર્યાતા કે સ્વીકારતા.

જૈન યતિઓનું આવું નિરૂપદ્ધ જીવન જનસમૂહના અંતરમાં એમના પ્રત્યે આદર અને બહુમાનની લાગણી ઉત્પન્ન કરે છે. તેઓ એક ઉત્તમ સાધક તરીકે પોતાની આત્મસાધના કરતા રહે છે; અને સાથોસાથ પોતાના સંપર્કમાં આવતાં નર-નારીઓને, એમની યોગ્યતા અનુસાર, અહિંસા, સત્ય, અરતેય, દ્વા, દાન, પરોપકાર, સેવા-ગુણ્યો, દીન-હૃદ્દી જનો પ્રત્યે સહાતુભૂતિ, એમની સહાયતા તેમ જ રાજ્ય તથા સ્વર્ધમની રક્ષા વગેરે સદ્ગ્યારપોષક સહગુણોના સંરક્ષારોનો વિકાસ કરવાની દિલ્લિએ સહૃપદેશ આપતા રહે છે.

જૈન યતિજીનોના આવા સદ્ગ્યાર-પોષક ઉપદેશને કીલાને હજારો માણુસો એમના શ્રદ્ધાળુ અનુયાયી બની જતા હતા, અને એમણે બતાવેલા ધર્મમાર્ગનું અનુસરણા કરતા રહેતા હતા. પદ્ધિમ ભારતમાં અત્યારે જેટલી જૈન વિષિણુ જીતિઓ ડે જેટલા સમાજે હ્યાત છે તે બધાંય આ જૈન યતિઓના સહૃપદેશોને લાઘુ સંરક્ષારસંપત્ત બની શક્યાં છે. આ જૈન સમૂહોએ પદ્ધિમ ભારતના સમગ્ર લોકજીવનના ધડતર અને વિકાસમાં ધણ્યો મહત્વનો ફ્રાળો આપ્યો છે. આ જૈન સમૂહો દેશની રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં હુમેશાં પોતાનો ફ્રાળો આપતા રહેવાની વિશિષ્ટ ફરજ બળવતા રહ્યા છે. એનો ધર્તિહાસ ધણ્યો વિશાળ તેમ જ પ્રમાણુભૂત છે. પણ હજ સુધી એના ઉપર જોઈ એ તેટલો પ્રકાશ પાડવાનો યોગ્ય પ્રયત્ન નથી થયો.

આ જૈન યતિઓ જનસમૂહને સંરક્ષારસંપત્ત કરવા માટે જેમ હુમેશાં ઉપદેશ આપતા રહેતું એ જ રીતે તેઓ જાતે જુદા જુદા વિષયોનું વિશિષ્ટ સાન મેળવતા રહેતા અને પોતાથી બિન્ન દેશકાળમાં રહેનાર ડે થનાર જિજ્ઞાસુઓને પોતાની જાનોપાસનાનો લાભ મળતો રહે એટલા માટે નવા નવા ગંધોની રચના કરીને દેશની સાહિલિક સમૃદ્ધિમાં પણ વધારો કરતા રહેતા. જૈન યતિઓએ રચેલ સાહિત્ય ધાર્યાં વિપુલ છે. છેલ્દાં એક હજાર વર્ષના ભારતીય સાહિત્યનો વિસ્તૃત ધર્તિહાસ લખવામાં આવે તો સંપ્રાણી જૈન યતિઓને એમાં ધાર્યાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થઈ શકે એવી એમની સેવાઓ છે.

આ જૈન યતિઓ કે મુનિઓ પોતાના ધર્મ અને સંપ્રદાયના ર્ભર્મજી વિદ્ધાન તો થતા જ હતા, પરંતુ એમના જ્ઞાનજ્ઞન અને જ્ઞાનદાનનું ક્ષેત્ર સર્વવ્યાપક અને સર્વતુભવવાળું રહેતું હતું. તે તે સમયમાં જ્ઞાત અને પ્રવર્તતી વિદ્યાઓની બધી શાખા-પ્રશા આઓનું આ વિદ્ધાનો થયેષ્ટ આકલન, અધ્યયન, ચિંતન-મનન, આલોચન અને સર્જન કરતા રહેતા હતા. જેમ એમની જ્ઞાનપિપાસા અપરિમિત હતી, તેમ એમની જાનોપાસના પણ એવી જ ઉલ્કટ અને અસાધારણ હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, કોષ, છંદ, અલંકાર, ન્યાય, પ્રમાણુશાસ્ત્ર વગેરે શાલદશાસ્ત્ર ડે તત્ત્વવિવેચનને લગતાં શાસ્ત્રોનું અધ્યયન કરવા ઉપરાં જ્યોતિષ, વૈદ્યક, શિલ્પ, શકુન, વર્ષાવિજ્ઞાન, પ્રશ્નપરિજ્ઞાન, રમલ વગેરે બધી જાતનાં શાસ્ત્રોનું પણ એવું જ અધ્યયન, અવલોકન અને સર્જન કરતા રહેતા. કેટલાય જૈન આચાર્યો અને યતિનાયકો મંત્રવિદ્યા અને તંત્રવિદ્યામાં નિર્પુણ હતા. જૈન ધર્તિહાસના અંગભૂત ગ્રાચીન પ્રમાણો અને ઉલ્લેખો મુજબ એવા અનેક મોટા જૈન આચાર્યોનું વર્ણન મળ્યો આવે છે કે જેઓ મોટા ભાંતિક અને તાંત્રિક હતા. પોતાની આ વિદ્યાને બધે એમણે એ વખતના જનસમૂહો ઉપર મોટો ઉપકાર કર્યો હતો; પોતાના દેશવાસીઓનાં આંતર-ખાલી કષે દૂર કરવામાં ધણ્યી મહદ્વ કરી હતી. તેઓ સદ્ગ્યારનું આચરણ કરવાની પ્રેરણા તો આપતા જ રહેતા હતા; પણ અવસર જોઈ ને લોકોને નીતિમાર્ગનું અનુસરણ કરવાની પ્રેરણા આપીને રાજ અને પ્રજાની ફરજનેનું અને આદરવા યોગ્ય વ્યવહારોનું પણ માર્ગદર્શન કરાવતા રહેતા હતા.

એમના જ્ઞાન અને ચારિત્રયણને લાઘુ એમના પ્રત્યે શ્રદ્ધા ધરાવતા અનુયાયીઓ તો એમના સહૃપદેશને માથે ચડાવવાને માટે હુમેશાં તત્પર રહેતા જ હતા; પરંતુ જેઓ એમના અનુયાયી ન હતા

## ૨૮૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ અન્ય

એવા અનેનો પણ એમનો અહા અને લક્ષિતપૂર્વક હમેશાં આદર કરતા રહેતા હતા. નગર અને દેશ ઉપર શાસન ચ્યાવતા રાજાઓ વગેરે પણ એમનાં ઉપદેશ અને સલાહ-સૂચનાનો લાભ લેતા રહેતા હતા.

ઉપર સૂચવવામાં આવ્યું છે તે ગ્રમાણે જનસમૂહની સાંસ્કારિક તેમ જ સામાજિક ઉત્તીતમાં આ વિદ્યાનોએ જેવો ક્રાંતિ આપ્યો છે, એવો જ ક્રાંતો એમણે દેશની સાલિસિક સમૃદ્ધિને વધારવામાં આપ્યો છે. આ વિદ્યાનોએ, ઉપર સૂચવ્યા તેવા, જુદ્ધ જુદ્ધ વિષયને લગતા હન્દો અંથો ગ્રાન્ટુત અને સંસ્કૃત ભાષામાં લખ્યા છે, જે કુમે કુમે પ્રસિદ્ધ થતા જય છે. સંસ્કૃત, ગ્રાન્ટુત, અપંશ ભાષા ઉપરાંત ગ્રાન્ચીન રાજરથાની, ગુજરાતી વગેરે જેવી દેશ્ય ભાષાઓની સમૃદ્ધિને વધારવા માટે આ વિદ્યાનોએ આ દેશ્ય ભાષામાં અસંખ્ય અંથોની રચના કરી છે. દેશ્ય ભાષાઓની ચા રચનાઓમાં, મુખ્યત્વે, સામાન્ય જનસમૂહને સંભળાવવાની દસ્તિએ કથા-વાર્તા જેવા લોકપ્રિય અને લોકભોગ્ય સાલિસિક એમણે સર્જન કર્યું છે. ભાષાવિકાસ અને વિચારપ્રકાશની દસ્તિએ, જૈન ધતિઓએ સર્જેલું આ દેશ્યભાષા-સાહિસ પણ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આ ધતિઓએ દેશ્ય ભાષામાં ડેવણ પોતાના સંપ્રદાયને લગતી ગ્રાન્ચીન કથા-વાર્તાઓને જ ઉતારી છે એવું નથી; એમણે તો દેશના સમગ્ર જનસમૂહમાં ગ્રચિત લોકકથાઓ તથા ઐતિહાસિક પ્રયંકોનું પણ દેશ્ય ભાષામાં એવું જ વિશિષ્ટ અવતરણ, ભાષાંતર કે આલેખન કરીને પોતાની કવિત્વશક્તિનાં ખીલેલાં પુષ્પોથી માતૃભાષાસરણ સરસ્વતીમાતાની ચરણપૂજન કરી છે.

### હેમરતનકૃત ચૌપદ્ધ

અહીંથાં આવા જ એક ધતિજી દ્વારા ગ્રાન્ચીન રાજરથાની ભાષામાં, અથવા જેને અમારા ફેટલાડ વિદ્યાન મિત્રો મારુ-ગૂર્જર તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે તે ભાષામાં, રચવામાં આવેલી ભારતના ધતિહાસની ખૂબ કરુણું છતાં અસ્યંત ગૌરવશાળી કથારણ વીરગાથાનો કંઈક પરિચય આપવામાં આવે છે.

આ કથાકાબ્યનું નામ “ગોરા-યાદલ-પદમની-કથા-ચૌપદ્ધ”—અપરનામ “ગોરા-યાદલ-ચરિત્ર” છે. એના કર્તા ધતિ હેમરતન નામે કહ્યા છે. આ કાબ્યમાં ચિતોડની જગ્ઘગ્રાન્ચિત પદ્ધિનીની આપ્યી કથા વર્ણવવામાં આવી છે.

### પદ્ધિનીની કથાની લોકપ્રિયતાનાં કારણ

ચિતોડની રાણી પદ્ધિની કે પડ્ઘાવતી ભારતીય લોકમાનસમાં એક વિશિષ્ટ વીરાંગના કે સતી નારી ઇથે સનાતન સ્થાન પામી ચુકી છે. એ રામાયણી સતી સીતા અને મહાભારતની દ્રૌપદીના સંયુક્ત અવતારણ આર્થિનારીના અદ્ભુત પ્રતીક સમાન હતી. તેથી ભારતની જુદી જુદી લોક-ભાષામાં આ વિષયને લગતું વિપુલ સાહિય રચાયું છે. કથા, વાર્તા, નાટક, નવલકથા તેમ જ કવિતારણે એની છદ્યંગમ કથા ભારતના ખૂબે ખૂબે પહોંચી ગઈ છે.

પદ્ધિનીની કથા ખૂબ લોકપ્રિય થઈ તેનાં કારણો અનેક છે : એક તો એ ખૂબ ઇપવતી અને ગુણવતી શ્રેષ્ઠ નારી હતી. ભારતમાં ગ્રાન્ચીન સમયથી જેનું વિશિષ્ટ ઐતિહાસિક અને લૌણોવિક મહત્વ લેખાતું આવ્યું છે તે વિખ્યાત તેમ જ સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પરિપૂર્ણ એવો ચિતોડહર્ણ એની રાજધાની હતો. ભારતના ગ્રાન્ચીનમાં ગ્રાન્ચીન રાજવંશોમાંના એક ખૂબ ગૌરવશાળી ગુહિલોત રાજવંશની એ રાજરાણી હતી. ભારતના ધતિહાસમાં પ્રલયકાળ સમા દિલ્લીના દુષ્ટ રલેચ મુસલમાન સુલતાન અલાઉદીનની કૂર કુદાણ એના ઉપર પડી હતી. એ વિષયલોકુપ, મદાંધ, ધર્મ-ધ્વંસક, ખૂની, તુર્ક મુસલમાન ભારતની હિંદુ જાતની એ સર્વશ્રેષ્ઠ નારીનું સતીત્વ નષ્ટ કરીને એને પોતાની ગુલામ-ખાંડી

## જૈન કવિ શ્રી હેમરલનિરચિત વીરગાથા : ગોરા-પાદલ-પદમની-કથા-ચૌપદી : ૨૮૯

બનાવવા ચાહતો હતો; અને એમ કરીને એ હિંદુ જલિના ધાર્મિક અને સાંસ્કૃતિક હૃદયનું ખૂન કરીને એને પોતાના કથાસ્તાનમાં દેઝનાવવા ચાહતો હતો. અલાઉદીને માન્યું હશે કે ચિત્તોડ એ તો નાનુસરખું રાજ્ય છે; એની લશકરી તાકાત કંઈ મોટી નથી; એ કિલ્લા ઉપર ચાપડી વગાડતાં કણજો થઈ જશે, અને ભારતની એ ઓષ્ઠ નારીને સહેલાદ્ધથી મારા અંત:પુરમાં હું દાખલ કરી શક્શીશ. પણ ચિત્તોડના સુદીલર વીરોએ એના આકમણુંનો દઢતાપૂર્વક સામનો કર્યો. એને મહિનાઓ સુધી લાં પડાવ નાખીને પડ્યા રહેવું પડ્યું, અને પોતાના સેંકડો ચુંનંદા સૈનિકોનાં માથાં કપાવા ટેવાં પડ્યાં. લડતાં લડતાં જ્યારે ચિત્તોડના ખધા વીરો ખપી જવા આવ્યા લારે પદ્ધિનીએ પોતાના વીરોને ડેસરિયાં કરવાનું કહીને, એમના કપાળમાં અક્ષત-ચંદ્રનાં તિલક કરીને, એમને વિદાય કર્યા; અને પોતે, પોતાના સમર્સત નારીસમૃદ્ધાયની સાથે, પદ્ધિની સરોવરમાં સ્નાન કરીને અને ભગવાન શંકરની અભિનપૂર્વક પૂજન-પ્રાર્થના કરીને, મંગળ ગીત ગાતી ગાતી ચિત્તા ઉપર એસી ગઈ! જેતનેતામાં એની અને એની સાથેની અધી સતી નારીઓની સોનલવર્ણી કાયા, ચિતાની સોનલવર્ણી જ્વાળાઓમાં લળી જઈને, રાખનો પુંજ ઘની ગઈ! જેમ કિલ્લામાં લડભડતી ચિતાની જ્વાળાઓ શાંત થઈ ગઈ એમ કિલ્લાની નીચેની રણભૂમિમાં રણ્ણવીરોની રક્તધારા પણ વહેતી બંધ થઈ ગઈ! કિલ્લાના દરવાળ ઉધાડા પડ્યા હતા અને રાજમહેંદ્રો સ્ફૂર્તા થઈ ગયા હતા! જ્યારે અલાઉદીન કિલ્લા ઉપર પહોંચ્યો લારે એ પોતાના રાજક્રિયા અમીર ખુસરુ સામે જોઈને કોઈક ‘હુદ હુદ’ ને માટે ખૂબો પાડી રહ્યો હતો; પણ લાં ‘હુદ હુદ’ કર્યાં હતી? ઇકત રાખના પુંજમાંથી રાખની ઝીણી રજ લાડિબાની એની ગોજારી આખોમાં પડી રહી હતી; જેથી એ, પોતાનું કાણું મોં છુપાવતો છુપાવતો અને પોતાની ધૂણુરસપદ આંખોને ચોળતો ચોળતો, હતાશ થઈને ખાલી હાથે દિલ્લી પાછો ફરી ગયો!

પદ્ધિનીની જીવનકથાનું આટલું જ સારભૂત વૃત્તાંત છે; પણ એ એટલું તો ઉદાત અને ભાવોસેજક છે કે પ્રયેક હિંદુ સંતાન એને સાંલળાને રોમાચિત થઈ જય છે. આભાલવૃદ્ધ બધાં ખ્રી-પુરુષો આ કથાનું અવણ કરીને લાગણીબીનાં ઘની જય છે. હિંદુ જલિના હસ્તિને જ ખતમ કરી નાખે એવા પ્રલયકાળ સમાં એ યુગમાં એક આર્દ્ધ સન્નારી એવી થઈ, જેણે પોતાના સતીત્વ અને જલીય ગૌરવની રક્ષા માટે પોતાના પ્રાણનું એની રિતે બલિદાન આપી દીધું કે જેણે લિધે હિંદુ જલિના ગૌરવની દિવ્ય જ્યોતિ આજ સુધી પ્રકાશમાન રહી છે. આને લિધે પદ્ધિનીની કથા, એ મૂળ ધરના ઘની ત્યારથી જ, માળવા, ગુજરાત વગેરે પ્રદેશોની જનતામાં ખૂબ લોકપ્રિય થઈ ગઈ હતી; અને આભાલવૃદ્ધ જનસમૂહમાં ખૂબ લક્ષિત, ઉલ્લાસ અને ગૌરવપૂર્વક કહેવા-સાંલળવામાં આવતી હતી—રાજરથાનથી દૂર છેક પૂર્વ ભારતમાં પણ.

પદ્ધિનીની કથાની આવી હૃદયરસપર્શિતા, વિશિષ્ટતા અને લોકપ્રિયતાથી પ્રભાવિત થઈ ને જ જયસી જેવા મુસલમાન કવિ પણ અવધી લાખામાં આ કથાને ‘પદમાવત’ નામથી કવિતાથ૰ કરવા પ્રેરણા હતા. જયસીની આ કવિતા પણ, કથાની સુખ્ય નાયિકા પદ્ધિનીની જેમ, સારા પ્રમાણમાં લોકપ્રિય બની છે. આ કૃતિની રચના પ્રાચીન હિન્દીની અવધી બોલીમાં થયેલ હોવાથી ઉત્તર ભારતમાં એનો પ્રચાર વિશેષ થયો છે.

### ઔતિહાસિક સામચીનો અભાવ; સાહિત્યિક સામચીની પ્રાપ્તિ

કાળના પ્રલાસે જ્યારે મોટા-મોટા સામાણોનાં જીવન સંબંધી પણ આપણને થોડીક પણ ઔતિહાસિક સામચી મળી શકતી નથી, લારે પદ્ધિની જેવી એક નાના સરખા રાજ્યના શક્તિહીન રાજની રાણી સું બ્ર૦ ૧૬

સંખ્યાએ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થવાની આશા રાખવી વ્યર્થ છે. આમ છતાં પદ્ધિતી એક મોટી ભાગ્યશાળી રાણી છે કે જેના સંખ્યાએ તથાતથભિશ્ચિત, ઈતિહાસનો આલાસ કરાવતી કેટલીક સાહિસિક રચનાઓ મળી આવે છે. કવિ હેમરલનવિરચિત ‘ગોરા-આદલ-પદમની-કથા-ચૌપદી’ આવી રચનાઓમાંની એક રાજરસ્થાની ભાષાની વિશિષ્ટ કૃતિ છે.

### કવિ જાયસીકૃત ‘પદમાવત’

આમ તો, આગળ સૂચયંતું તેમ, મુસલમાન સ્ફુરી કવિ જાયસીએ અવધી ભાષામાં રાણી પદ્ધિતીની જીવનકથા સંભળાવતું ‘પદમાવત’ નામે સુંદર, પ્રૌઢ કાવ્ય રચયું છે. એ કાવ્ય હેમરલનકૃત ‘ચૌપદી’ કરતાં આશરે અરધી સહી પહેલાં રચાયું છે. જાયસીની આ કૃતિ હિંદુ-ભાષા-સાહિત્યમાં એક ખૂબ મહત્વની અને ઉત્કૃષ્ટ કોટિની રચના મનાય છે; અને એના ઉપર અનેક વિદ્ધાનોએ વ્યાખ્યા, વિવેચન કે સમાલોચનારૂપે ગ્રંથ, નિબંધ કે પ્રથ્યંધ લખ્યા છે. આ કૃતિમાં જાયસીએ પદ્ધિતીના જીવનનું વર્ણન વિશુદ્ધ કથારૂપે નહિ પણ આદંકારિક ભાષામાં મહાકાવ્યની ફેદે કર્યું છે. કવિ જાયસી સ્ફુરી વિચારસરણીનો અનુયાયી હતો. એનું ધ્યેય હિંદુ જનતામાં ખૂબ લોકપ્રિય અને અધ્યાસપદ બનેલી સત્તી પદ્ધિતીની આયાવગોપાલપ્રસિદ્ધ લોકકથાને સ્ફુરી વિચારસરણી અને કલપનાના રંગે રંગિત કરીને એ કથાને વાંચવા-સાંભળવાવાળાઓને પોતાના સંપ્રદાયની વિચારસરણી તરફ આકર્ષિત કરવાનું હતું. જાયસીના સંસ્કાર અને ભાવ છસ્ત્વામી સંસ્કૃતથી રંગયેલા હતા, અને એનો ઉછેર હારસી-અરણી ભાષાના સાહિત્યની પરંપરામાં થયો હતો, તેથી એની કૃતિમાં અનુરૂપ ભાવાલિબ્યક્તિ થવા પામી છે. આમ છતાં એ કવિ હિંદુ વિચારસરણી, ભાવાલિબ્યક્તિ અને સાહિત્યશૈલીથી સુપરિચિત હતો, તેથી એની રચનામાં વિશેષ લેખભાવ નજરે નથી પડતો; અને તેથી એની રચના હિંદુઓને માટે પણ એટલી જ સ્વીકાર્ય અને આદરપાત્ર બની શકી છે.

### પ્રસ્તુત કૃતિનું ઐતિહાસિક મહુસ્વ

જાયસીકૃત ‘પદમાવત’ જેમ ઉત્તર ભારતમાં વિશેષ પ્રચલિત બન્યું તેમ રાજરસ્થાન, ગુજરાત, ભાગવા જેવા પદ્ધિત ભારતના પ્રેદેશોમાં કવિ હેમરલનની પ્રસ્તુત રચના વિશેષ પ્રસિદ્ધ હતી. આ કવિ વિદ્ધાન જૈન યત્નિ હતા. એમની ભાષા સુપરિષ્ટુત રાજરસ્થાની છે; પણ એની રચના મારવાડ, મેવાડ, ભાગવા અને ગુજરાતના પ્રેદેશોમાં સમાનરૂપે ઉપયોગમાં દેવાતી શૈલીમાં થયેલી છે.

ઐતિહાસિક દાખિયે આ કૃતિ વિશેષ મહુસ્વ ધરાવે છે. કવિએ પોતે જ આ કૃતિની પ્રશસ્તિમાં (A પ્રતિની પ્રશસ્તિની છથી જેમી કડીઓમાં) જાણ્યાંયું છે તે તે પ્રમાણે આ ચૌપદીની રચના ઉદ્ઘાપુર રાન્ય અને એના રાજવંશ સાથે વિશેષ સંખ્યાં ધરાવતા, ઓસવાલ જાતિના, કાવજિયા ગોત્રના તારાચંદની ભાગણીથી કરવામાં આવી હતી. આ તારાચંદ ઈતિહાસપ્રસિદ્ધ દેશલક્ષ્ણ વિર ભામાશાહનો નાનો ભાઈ થતો હતો; અને ભાગારણ્ય પ્રતાપનો વિશ્વાસુ રાજ્યાધિકારી હતો. સુપ્રસિદ્ધ હલ્દીધાટના ખુદ્ધમાં ભામાશાહની સાથે તારાચંદ પણ એક અચ્છાણી યોક્ષો અને સૈન્યનો સંચાલક હતો. એણે ચિત્તોડના રાજવંશની રક્ષાને માટે એનેક પ્રકારે સેવાઓ આપી હતી; તેથી એના અંતરમાં ચિત્તોડની ગોરવગાયાનું ગાન કરાવવાનો ઉલ્લાસ હોય એ સ્વાભાવિક છે. જ્યારે કવિ હેમરલન વિ.૦ સં. ૧૧૪૫નું ચોમાસુ સાદી નગરમાં રણા તે વખતે તારાચંદ ત્યાં મોટા રાજ્યાધિકારીને પદે હતા. જૈન સમાજની પરંપરા પ્રમાણે તારાચંદ ધર્મગુરુઓને વંદન કરવા તેમ જ એમનો ઉપદેશ સાંભળવા, યથાસમય, જૈન ઉપાય્યમાં જતા રહેતા હતા. યતિ હેમરલન સારા કવિ હતા અને ધર્મોપદેશમાં તેઓ પોતાની રચનાઓને આધારે

પ્રવચન કરતા હતા. તારાચંદ એમની આવી કૃતિઓને સાંભળીને ખૂબ પ્રસન્ન થતો. એકવાર અવસર જેઠિને એહે કવિ હેમરતને વિનિતિ કરી કે તેઓ ચિત્તોડના ચિત્તિહાસની પદ્ધિનીની ગૌરવલરી ઓર્તિકથાનું પોતાની હૃદ્યરપશી કાબ્યમય વાણીમાં ગાન કરે. તારાચંદની આ પ્રાર્થના ઉપરથી હેમરતને આ કાબ્યકૃતિ રચનાની શરૂઆત કરી, અને વિ.૦ સં. ૧૬૪૫ના શ્રાવણ શુદ્ધ પાંચમના હિંસે એ પૂરી કરી. કવિના કહેવા મુજબ આની રચના વખતે મહારાણા પ્રતાપ હૃદાત હતા. \*

આ ચૌપઈના રચનાકાલથી આશરે ૨૦-૨૧ વર્ષ પહેલાં અકબરે ચિત્તોડનો સર્વનાશ કર્યો હતો; અને એ હુઃખ ધટનાની બહુ ધેરી અસર મેવાડની જનતાના ચિત્ત ઉપર થઈ હતી. ચિત્તોડના પતનથી ૧૧ વર્ષ પછી થયેલ હલ્દીધાટના યુદ્ધમાં તારાચંદ પણ એક શરૂવીર યોજ્ઞા તરીકે હાજર હતો. મહારાણા પ્રતાપના એ સુરક્ષિત પહાડી પ્રદેશના મારવાડ અને ગુજરાતના ધોરી માર્ગ ઉપર આવેલું એ સાહી નગર એક મહત્વનું નાંકું હતું. અરવલીનાં દુર્ગમ સ્થાનો અને માર્ગનું એ પ્રવેશદ્વાર હતું. તેથી એના રક્ષણુનો ભાર મહારાણા પ્રતાપે તારાચંદને સોષ્યો હતો. એ તારાચંદના જ આગ્રહથી, એ સાહી નગરમાં આ ચૌપઈની રચના થઈ હતી, તેથી આ રચનાનું આ ઐતિહાસિક મહત્વ પણ છે.

કવિ હેમરતની આ ચૌપઈ ખૂબ લોકપ્રિય થઈ હતી. ચિત્તોડની પદ્ધિનીની કથામાં ગોરા અને ખાદ્યની સ્વામિલક્ષીનું અનુપમ ઉદાહરણ આવે છે; એમણે અદ્ભુત રીતે ચિત્તોડના ગૌરવનું રક્ષણું એનું વર્ણન આપ્યું છે. આ કાબ્યની રચના થઈ તે વખતે જ આની અનેક નકલો થઈ હતી, અને મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત વગેરે પ્રદેશોમાં એનો ખૂબ પ્રચાર થયો હતો.

### લખધોદ્યકૃત ‘પદ્ધિની-ચારિત્ર-ચિપઈ’

આ ચૌપઈના અનુકરણ ઇપે, પણીથી, બીજા કવિઓએ પણ આ કથાને પોતાની કવિતા-વાણીમાં ગુંથી છે. એમાં લખધોદ્ય કવિએ રચેલી આવી જ એક ‘પદ્ધિની-ચારિત્ર-ચિપઈ’ નામે રચના છે, જે હેમરતની રચના ખાદ્ય આશરે ૧૦-૧૨ વર્ષ પછી (વિ.૦ સં. ૧૭૦૬-૭માં) રચાઈ છે. લખધોદ્ય પણ, કવિ હેમરતની જેમ, વિદાન જૈન ધર્મની હતા. તેઓ પણ લોકપ્રિય ધર્મકથાઓને પોતાની કવિતામાં ગુંથીને ધર્મોપદેશ વખતે એના ઉપર પ્રવચન કરતા રહેતા હતા. તેઓ ખરતરગઢની પરંપરાના ધર્મની હતા. સંવત ૧૭૦૬-૭માં તેઓ ઉદ્ઘપુરમાં ચોમાસુ રહ્યા હતા. એ વખતે એમના ગરુદના આગેવાન, ઓસવાલ જાતિના, કટારિયા ગોત્રના લાગયંદે એમને પદ્ધિનીની કથાને ચિપઈમાં ઉતારવાનો અનુરોધ કર્યો. લાગયંદનો મોટો ભાઈ હંસરાજ ઉદ્ઘપુરના મહારાણા જગતસિંહની માતા જંધૂવતીનો કારલારી હતો. લાગયંદનો એક મોટો ભાઈ કુંગરસી નામે હતો; એને ધર્મકરણીમાં ખૂબ આસ્થા હતી. એમની પ્રેરણાથી

\* સંદેશ સોહિ સંદેશ પણ્યાલ, આવણ સુદુ પણ્યાભી સુવિસાલ ।

કુહણી પીઠી વાણું પરગડી, સખલ પુરી સોહિ સાદરી ॥૪॥

ખૂથની પરગડ ચાણું પ્રતાપ, પ્રતપદ દિન દિન અધિક પ્રતાપ ।

તસ મંત્રિસર જુદ્ધિનિધાંન, કાવેદ્યા કુલતિલક નિધાંન ॥૫॥

સાંભિ ધરમિ કુરિ બાણું સાહ, વયરી વંસ વિધુંસણ રાહ ।

તસુ લધુ ભાઈ તારાચંદ, અથન લાણુ અથતરણ ધંદ ॥૬॥

ધૂધ જિમ અવિચક પાલદ પરા, શાનુ સહુ શીધા પાધરા ।

તસુ આદેશ લહી સુભ ભાઈ, સભા સહિત પાંભી સુપસાધ ॥૭॥

—A પ્રતની પ્રશસ્તિ

## ૨૬૨ : શ્રી મહાવીર જૈન વિધાલય સુવર્ણમહોત્સવ અન્થ

લખ્યોદ્યે 'પદ્મિની-ચારિત્ર-ચક્રપર્દી' નામે કાવ્યની રચના કરી. હેમરતનની રચના મુખ્યત્વે દોહા અને ચૌપદ્ધ છંદમાં થયેલી છે, લારે લખ્યોદ્યે પોતાની રચના જુદા જુદા દેશી રાગોની ગીતમંડ શૈલીમાં કરી છે; પણ એની કથાનું મુખ્ય વર્ણન હેમરતનની કૃતિને આધારે જ કરવામાં આવ્યું છે. આ ચક્રપર્દી પીકાનેરના 'સાહૂલ રાજ્યસ્થાની રિસાયે ધનિસ્ટર્ટયૂટ' તરફથી તાનેતરમાં અગ્રટ થઈ છે. એની સાથે કોઈ પ્રાચીન કવિ મલ્લે રચેલ 'ગોરા-આદલ-કવિતા' તથા જાટમલ નાહારે રચેલ 'પદ્મિની-ચારિત્ર' અથવા 'ગોરા-આદલ-કથા' નામની કૃતિ પણું અગ્રટ કરી દેવામાં આવી છે.

### હેમરતનની રચનાના મૂળ મુદ્રા

હેમરતનની ચૌપદ્ધના મૂળ મુદ્રા આ પ્રમાણે છે : (૧) ચિત્રકૂટ નામે સુપ્રસિદ્ધ અને સુસમંડ દુર્ગનો રાજ ગુહિલોત વંશનો રતનસેન છે. (૨) એની પટરાણી પ્રભાવતી નામે છે, જે ઇપે-રંગે રંભા જેવી અને શીલવતી સતી નારી છે. (૩) એ ખૂબ પતિપરાણું અને હેતાળ છે. (૪) એક દ્વિપસ રાજન્યે જમતાં જમતાં રાણીની રસોઈની આવદતમાં કોઈક આમી બતાવી, તો રાણીએ હસતાં હસતાં મહેણું આર્થું કે મારી રસોઈ તમને ન ગમતી હોય તો પદમણીને પરણી લાવો ! (૫) રાજ એ મહેણાને સાચું કરી બતાવવા પદમણી નારીની શોધમાં નીકળી પડ્યો. (૬) ફરતાં ફરતાં સિંહલ દેશમાં પદ્મિની રાજકુમારી હોવાનું એના જાણવામાં આવ્યું. (૭) એ ખૂબ જહેમત ઉડાવીને સિંહલ દેશમાં પહોંચ્યો અને પોતાની હોશિયારીથી પદ્મિનીને પરણી લાવ્યો. (૮) રાધવચેતન નામે એક આલાણું રાજના દરખારમાં હતો; એ પોતાની વિધાથી રાજને પ્રસન્ન કરતો હતો. (૯) પણ, કોઈક અનુચિત ધરનાને લાઘે, રાજને એ આલાણના ચારિત્ર ઉપર સંદેહ જય છે, અને તેથી રાજ એનું અપમાન કરીને એને ત્યાથી કાઢી મૂકે છે. (૧૦) આલાણું ગુરસે થઈ ને રાજ ઉપર દ્રોપ ધારણું કરીને, વેર લેવાની બુદ્ધિથી, દિલ્લીના બાદશાહ અદાઉદીનના દરખારમાં પહોંચી જય છે. (૧૧) ત્યાં પણ એ પોતાની તાત્ત્વિક વિધાથી બાદશાહને ખુશ કરે છે, અને બાદશાહની કામવાસના ઉત્તેજિત થાય એ રીતે ચિત્તોડના રાજની રાણી પદ્મિનીના અનુપમ સૌંદર્યનું વર્ણન કરે છે. (૧૨) લંપટ બાદશાહ પદ્મિનીને મેળવા માટે મોટા લશકર સાથે ચિત્તોડ ઉપર ચાઠી કરે છે. (૧૩) ધણું પ્રયત્ન, સંધર્ષ અને બળનો ઉપયોગ કરવા છતાં જયારે એ ચિત્તોડનો કિલ્લો નથી જીતી શકતો ત્યારે એ છળ-કંપટ રચ્યો, રાજને બ્રમભાં નાખીને, કિલ્લો જોવાને બહાને રાજનો મહેમાન અને છે. (૧૪) રાજ એક ક્ષત્રિયને છાને એ રીતે એનું આતિથ્ય કરે છે, પણ એ વિશ્વાસધાતી સુલતાન કિલ્લાથી બીતરતી વખતે રાજને ડાદ કરીને પોતાની ધાવણીમાં લઈ જય છે. (૧૫) બાદશાહ રાજને ખૂબ હુંઘ આપે છે; અને એ નેટ્ઝ-સાંલળાને બધા ચિત્તોડનિવાસીઓ લારે મુસ્લિમતમાં મૂળવણું પડી જય છે અને રાજને ડેવી રીતે છોડાની શક્યતા એનો ઉપાય વિચારવા લાગે છે. (૧૬) એ વખતે અલાઉદીન પોતાના દૂતને કિલ્લામાં મોકલ્લાને કહેવરાવે છે ડાને મને રાણી પદ્મિનીને સૌંપી દેવામાં આવશે તો હું રાજને છોડી મૂકીશ અને ચિત્તોડનો ધેરો ઉદાધીને ચાલકો થઈશ. (૧૭) રાજની પટરાણીનો પુત્ર વીરભાણ, જે પોતાની ઓરમાન માતા પદ્મિની તરફ દ્રોપલાખ ધરાવતો હતો, એ પોતાના સરદારોને કહે છે કે 'જે ચિત્તોડની અને રાજની રક્ષા કરવી હોય તો પદ્મિનીને સુલતાનને સૌંપી દીધા સિવાય બીજો કોઈ ઉપાય નથી.' (૧૮) પદ્મિનીને કાને જયારે આ વાત જય છે ત્યારે એ ખહુ ખિન થાય છે. એક બાજુ ચિત્તોડની અને પોતાના પતિની રક્ષાનો સવાલ છે, અને બીજુ બાજુ પોતાના સતીત્વ અને કુળધર્મની મર્યાદાની રક્ષાનો પ્રશ્ન છે. એને પોતાના જીવનની રક્ષાની તો કશી જ ચિંતા નથી. એ વિચારે છે : 'હું તો પળમાત્રમાં મારા પ્રાણુનો લાગ કરીને મારા સતીત્વની રક્ષા કરી શકું છું : જીવતેજુવ તો હું કૃયારેય એ દુષ્ટ સુલતાનના હાથમાં નહીં પડું; પરંતુ મારા પ્રાણ આપવા છતાં શું મારા સ્વામી બચી

શકરો અને ચિતોડનો સર્વનાશ થતો અટકી જરો ખરો ?' (૧૮) આ અંગે ડેટલોડ વિચાર કરીને પદ્ધિની પોતાના વિશ્વાસપાત્ર રાજ્યપૂત યોક્ષા ગોરા રાવતને ઘેર પહોંચે છે. ગોરા મોટો વીર અને પરાક્રમી રાજ્યપૂત છે, પણ કોઈ કારણુસર એ રાજ રતનસેનથી અસંતુષ્ટ બનીને રાજ્યદરખારથી અલિપ્ત રહે છે. રાજ્યમાતા પદ્ધિનીની વાત સંભળાને એ ખૂબ ચિન્તામાં પડી જાય છે; અને આ આઇતનો સામનો ડેવી રીતે થઈ શકે એનો ઉપાય વિચારે છે. એનો એક લનીને બાદલ યુવાન, ધણો ખુદ્ધિશાળી અને ભારે શરૂપીર છે. ગોરા એની સાથે વિચાર કરે છે. કાકો-સત્રીને ઘને એક અદ્ભુત પ્રપંચ દ્વારા રાજને છોડાવી લાવવાની યોજના ધરે છે. રાણી પદ્ધિની એ સંભળાને રાજ થાય છે. (૨૦) પછી એ અન્ને યોક્ષાઓ રાજ્યદરખારથી અને મળાને એમને પોતાની યોજના સમજાવે છે. બધા એમની સાથે સહમત થાય છે; અને એ ગ્રભાણે બધી તૈયારી કરીને, પદ્ધિનીને બહાને પાલખીમાં ગોરા રાવતને છુપાવીને, અને યોગ્ય ખૂબ શોભા સાથે સેકડો પાલખીઓનો રસાલો લઈ ને તેઓ અલાઉદ્દીનની છાવણીમાં પહોંચે છે. બાદશાહ આ છળથી સાવ અગ્રાત છે, અને ભારે આતુરતાથી પદ્ધિનીનું સ્વાગત કરવાની ધડીની રાહ જોઈ રહ્યો છે. (૨૧) બાદલ સુપચાપ રાજને ગોરાની પાલખીમાં બેસારી દે છે, અને એને કિલ્લા તરફ રવાના કરી દે છે. એટલામાં વાતનો જેહ ખૂલી જાય છે અને સુલતાનની છાવણીમાં દોડધામ ભથી જાય છે. 'દ્રો ! દ્રો !' ની ખૂભો સાથે ત્યાં મારામારી અને કાપાકાખી શર થઈ જાય છે. પાલખીઓમાં છુપાયેલા સૈનિકો વીર ગોરાની આગેવાની નીચે અદ્ભુત વીરતા દાખ્યાને સેકડો દુશ્મન-સૈનિકોનો સંહાર કરી નાખે છે. ગોરા વીર શૌર્ય દાખ્યાને ત્યાં વીરગતિને પામે છે. (૨૨) પોતાની સેનાનો ભારે સંહાર થઈ જવાને લીધે સુલતાન હતાશ થઈ ને દિલ્લી પાછો ઇરી જાય છે. આ રીતે અદ્ભુત પરાક્રમ અને ખુદ્ધિભળથી રાજ રતનસેન અને રાણી પદ્ધિનીની રક્ષા કરવાને કારણે બાદલ વીરનો સર્વત્ર જ્યયજ્યકાર થાય છે.

હેમરતના આ મુદ્દાઓમાં અસંભવનીય ઘટનાનો થોડો પણ આભાસ નથી; બધી ઘટનાઓ કુમાર્દ અને બહુ જ સ્વાલાવિક રીતે વર્ણાવી છે. ડેટકેડાળે હેમરતને કથાના આધારભૂત ડેટલાંય પ્રાચીન કુવિત વગેરે આપ્યાં છે, ને નિઃશંકપણે પૂર્વવર્તી કુવિયોની રચનાઓમાંથી લેવામાં આવ્યાં છે.

### એક અસંગત વાત અને તેનો ઝુલાસો

હેમરતની કથામાં એ વાત અસંગત જેવી લાગે છે તે પદ્ધિનીને સિંહલ દેશની રાજકન્યા કહી છે એ છે. સિંહલની અત્યંત ઇપવતી રાજકન્યાઓની કથાઓને લીધે કથાકારોએ સિંહલને પદ્ધિનીનું પિયર ભાની લઈ ને એનો એ રીતે પ્રચાર કર્યો હોય એ બનાવાનેથી છે. રાજસ્થાનના મહાન ધતિહાસકાર સ્વ૦ ગૌરીશંકર ઓઝાજુએ આ અંગે એવી કથ્યના કરી છે કે રાજ રતનસેન સિંહલ જેટલા સુદૂરના પ્રદેશમાં જઈ ને પદ્ધિનીને પરણી લાભ્યો હોય એ કોઈ રીતે સંભવિત નથી. સંભવ છે કે પદ્ધિની મેવાના સિંગોલી જેવા રથાનની રાજકન્યા હોય અને ભારો વગેરેએ શાખદસામ્યને લીધે એનું 'સિંહલ' બનાવી દીધું હોય. જેકે ભારી પાસે કોઈ આધાર નથી, છતાં મારી કદમ્પના છે કે પદ્ધિની સિંહલ દેશની નહિ પણ સિંહલ અર્થાત પ્રસિદ્ધ સિંહ પ્રદેશના કોઈ રાજપૂતની કન્યા હો. સિંહલની ખીઓના ઇપ-લાવણ્યનું વર્ણન રાજસ્થાનના પાછળના કુવિઓએ ખૂબ કર્યે છે, અને સિંહલની ઇપવતી ખીઓને રાજસ્થાનની ખીઓના સૌર્યના પ્રતીક તરીકે વર્ણનવામાં આવી છે. કર્નલ ટોડે સિંહલના રાજ અને પદ્ધિનીના પિતાનું નામ હમીરસિહ લખ્યું છે, અને એને ચૌહાણ વંશનો કહ્યો છે. સિંહલ અર્થાત લંકામાં ચૌહાણ રાજનું હોવું સર્વથા અસંભવ છે. હમીરસિહ નામ પણ શુદ્ધ રાજસ્થાની છે. તેથી કર્નલ ટોડના આ ઉલ્લેખમાં કંઈ પણ તથ્ય હોય તો તે 'સિંહલ' ને સ્થાને 'સિંહલ' ભાની લેવાથી સાર્થક થઈ શકે છે, અને પદ્ધિનીની શરૂઆતની આખી કથા સંભવિત અને સંગત બની શકે છે.

### જયસી અને હેમરતની રચનાઓમાં તરફાવત

જયસી પદ્મિનીના વાસ્તવિક આત્માને પિછાનતો ન હતો. એને એના લોકવિશ્વુત ધતિહાસનું પણ વિશેષ જ્ઞાન ન હતું; એ ચિત્તોડના રાજ રતનસેનને ચૌહાણ માને છે. જયસી ડેવળ કાવ્યની દખિયે આ કથાનું આદેખન કરે છે. એના ભાવોમાં આત્મીયતાનો આભાસ નથી. એ વાચ્યતાં કવિતાનો આસ્વાદ તો મળે છે, પરંતુ કથામાં આવતાં પાત્રોના આદેખનમાં કોઈ પોતાપણાનું સંવેદન થતું નથી. એનાં વર્ણનો ખૂબ લાંબાં-લાંબાં અને ઉપમા વગેરે અલંકારોથી ભરેલાં છે. જણે કવિ આ કથા નિમિત્તે પોતાની કાવ્ય-શક્તિને દેખાડવા માગતો હોય એવો જ આભાસ આ રચના વાચ્યતાં થાય છે. જયસીએ ડેટલાંડ વર્ણનો તો એવો મુસલમાની ઢોળ ચડાવીને લખ્યાં છે કે જે સંરક્ષારી, ધર્મનિષ્ઠ હિંદુને સાંભળવાં કે વાચ્યવાં ન ગમે. હેમરતની રચના સહજ, અકૃત્રિમ, હૃદયંગમ અને ભાવોદ્ભોધક છે. પદ્મિની, રાજ રતનસેન, ગોરા-આદલ, રાધવચેતન અને અદ્વાજિદીન વગેરે બધાં પાત્રોનું આદેખન, તે તે વ્યક્તિતના સ્વભાવને અનુઝ્ય, સાવ આંદર વગરનું થયું છે. આંદો કોઈ જાતની કૃતિમાનો આભાસ સુધ્યાં નથી થતો. જણે એમ કાગે છે કે હેમરતન પોતાની આંદો દેખેલી ધર્યાનાઓનું હૃદય વર્ણન કરી રહ્યા છે. આ વર્ણન સાથે જાણે એનો આત્મીય સંબંધ અસિવ્યક્ત થાય છે. હેમરતની કૃતિમાં ભારતની એક શ્રેષ્ઠ સતી નારીના અખંડ શિલ્પતનું, સાચા સ્વામિબક્ત રાજપૂત યોજાના સ્વર્ધમ કાજે સમર્પિત થઈ જવાના ઉદાત જીવનવતનું અદ્ભુતભૂતી આદેખન જોવા મળે છે. હેમરતની આ રચના આપણું એક રાજ્યીય ગીત છે. હેમરતને જે રીતે પદ્મિનીની કથા વર્ણવી છે, લગભગ એ જ પ્રકારે એના સમકાળીન મુસલમાન ધતિહાસદેખકોએ પણ એ ધર્યાનું વર્ણન કર્યું છે.

### ધટનાની ઔતિહાસિકતા : ડોં કાનૂનગોના ભતનું નિરાકરણ

પણ, જયસીની અસંયદ અને અપ્રાસંગિક વાતોથી ભરેલી પદ્મિનીની કથા પ્રકાશમાં આવતાં, અનેક વાચ્યકોને એવી યથાર્થતા ઉપર શંકા થવા લાગી, અને અનેક ઔતિહાસિક નિરાસુઓ અને વિદ્યાનોએ એ સંબંધી ભાહાપોહ શરીર કર્યો. ભારતના પ્રાચીન ધતિહાસને શંકાની દખિયે જોનારાઓને પદ્માવતી—પદ્મિનીની કથાનો, જયસીના સમર્થી પહેલાંના સમયનો, કોઈ નિશ્ચાસપાત્ર સોત ન હેખાયો. તેથી તેઓ એવા અભિપ્રાય ઉપર આવ્યા કે—પદ્મિનીની આ કથા એ ડેવળ જયસીની કલ્પના જ છે; એમાં કોઈ ઔતિહાસિક તથ છે નહિ. અદ્વાજિદીને ચિત્તોડ ઉપર આકમણું કરીને એના ઉપર ધસલામનો ઝડો ફરકાબો, એનો ઉદ્દેખ અદ્વાજિદીનના પોતાના દરખારી લેખકોએ કર્યો છે; અને એમનામાં સૌથી મુખ્ય પ્રસિદ્ધ લેખક અમીર ખુસરુ પોતે ચિત્તોડના આકમણું વખતે અદ્વાજિદીનની સાથે હતો. એણે એ લડાઈનું વર્ણન કરતાં ચિત્તોડના રાજ રતનસેન અને રાણી પદ્માવતી કે પદ્મિનીનો જરાસરખો પણ નિર્દેશ કર્યો નથી. પછી અકબરના સમર્થમાં થયેલા મુસલમાન ધતિહાસદેખકો, જેમાં ફરિસ્તા અને અખુલફજલ વગેરેનો સમાવેશ થાય છે, એમણે પદ્મિનીની ધટનાનું વર્ણન કર્યું છે; પરંતુ તેઓ જયસી પછી થયા છે, એટલે એમની કથાનો મુખ્ય આધાર જયસીનું પદમાવત જ છે. એને જ આધારે પછીના હિંદુ ક્રવિઓએ પણ પદ્મિનીની કથાને પ્રચલિત કરી વગેરે વગેરે—આ ભતના મુખ્ય પ્રચારક છે સુપ્રસિદ્ધ ધતિહાસવેતા બંગાળના વિદ્યાન ડોં કાલિકારંજન કાનૂનગો.

ડોં કાનૂનગોએ પોતાની માન્યતાના સમર્થનમાં ડેટલાંડ તર્ક આપ્યા છે. એક તો એ કે અદ્વાજિદીનના સમકાળીન ધતિહાસદેખકોએ પદ્મિનીનો કશો નિર્દેશ કર્યો નથી. બીજું, જયસીની પહેલાં પદ્મિની સંબંધી કોઈ રચના ભળતી નથી. ત્રીજું, પછીથી થયેલા ભાટચારણોએ પદ્મિનીને લગતી જે કથ કહી છે એમાં પરસ્પરમાં વિસંવાદ અને કાળકમનો અસંયદ ઉદ્દેખ છે.

३० कानूनगो जेवा विचारकोनुं भंडन करनाराओमां राजस्थानना जाणुता। धतिहासरा ३० दशरथ शर्मा मुख्य छे. एमणे डेटलाङ्क पिंशिष्ट ऐतिहासिक प्रभाष्याने आधारे पद्मिनीनी कथाने धतिहाससिद्ध साधित करवानो प्रयत्न कर्यो छे. यिकानेरथी प्रगट थयेक, अगाउ सूचित, लघ्योहय, कविनी 'पद्मिनी-चौपर्छ'नी शहजातमां 'रानी पद्मिनी—ऐक विवेचन' शीर्षक ३० शर्माङ्गुनो ढूँडो छतां सारभूत लेख छपायो छे. एमां ३० शर्माङ्गुये ३० कानूनगोना तर्कोनो ज्ञापाय आपातां कहुँ छे के अल्लाउद्दीनना समझालीन लेखकोये पद्मिनी संबंधी यर्या नथी करी ए छुइकतने कोई प्रभण प्रभाष्य न लेखी शकाय; ए लेखकोये तो एवी अनेक बायतोनो उल्लेख नथी कर्यो के जे अन्य प्रभाष्योयी जाणी शकाय छे. जयसीनी पहेलां पद्मिनीना अस्तित्वनो सूचक कोई ऐतिहासिक उल्लेख नथी भएतो, एवो ३० कानूनगोनो भीन्ते तर्क पाणु भराभर नथी. जयसी पहेलां (सं० १५८८मा) 'छिताई वार्ता'मां रतनसेन, पद्मिनी, गोरा-आदल अने चितोडनी धटनानो २५४ उल्लेख भए छे. कोई अज्ञात कवि, लाट के चारणे रचेलां गोरा-आदलना चरित्रने लगतां कविता भणी आव्यां छे, जे भाषानी दृष्टिये जयसी पहेलांमा भावूम घडे छे. राज्ञ रतनसिंहनो सं० १३५८नो २५४ शिलालेख\* चितोडमांथी भणी आव्यो छे; एने आधारे ए वप्ते जे लानो राज्ञ हुतो ए निश्चित थाय छे. आ तर्कोने आधारे ३० शर्माङ्गुये एम पुरवार कर्यु छे के जयसीना 'पदमावत'नी पहेलां ज पद्मिनीनी कथा अने अल्लाउद्दीननी लंपटता सारी रीते जाणुती थाई चुक्की हुती.

हेमरत्नने जयसीना 'पदमावत' संबंधी करी जाणुकारी नहि हुती. एमणे तो राजस्थानमां परापूर्वथी लोकविष्यात बनेलां कथाभीजेने आधारे खोतानी स्वतंत्र कृति रची छे. ए २५४ कहे छे के 'सुणित तिसु भाष्यउ संबंध' (A प्रतिनी प्रशस्ति, कडी १०) अर्थात् मै जेवो संबंध सांख्यो तेवो कह्यो छे. वणी, कवि खोतानी रचनाना प्रारंभमां ज कहे छे के 'केळवस्युं साची कथा, काँण न आवह काह' (नीलु कडी) एटले के हुं साची कथा रचीश अने एमां कोई खोड अर्थात् असत्य नहि आववा ६७. आ रीते हेमरत्ननी कथा अने एनां मुख्य पात्रो भिलकुल ऐतिहासिक हुतां, एमां शंका नथी.

### पद्मिनीनी आ कथा सुखांत केम ?

आम छतां एक वातनुं आश्र्य थाया वगर नथी रहेतुं के हेमरत्न वगेरे राजस्थानना कविओये पद्मिनीना ज्ञाननी अंतिम धटना (खोताना पद्मिनी पाषण सती थावा) अंगे डेम कर्यु नथी लभ्यु ? आ राजस्थानी कविओ पद्मिनीनी कथाने सुखांत इपमां ज पूरी करे छे; अने ए कथानो जेवो करुणु अंत जयसीये वर्णव्यो छे, ए अंगे सर्वथा भौत सेवे छे, एम डेम बन्यु हरे ?

पद्मिनी संबंधी व्यधी कथाओमां सौथी वधारे संगत अने आधारभूत रचना कवि हेमरत्ननी प्रस्तुत कृति ज्ञानय छे. संख्य छे, पद्मिनीना करुणु अंत अंगे अने कोई विश्वासपान आपार जाणुना नहि भाल्यो होय, तेथी एमणे एनुं कोई सूचन नहि कर्यु होय अने राज्ञ रतनसेननी सुक्षितनी साथे ज आ कथाने सुखान्त इपमां पूरी करी दीधी होय.

### वीरगाथानी डेटलीक प्रसादी

सामान्य जनसमुदायमां राष्ट्रभावना के राष्ट्रीय चेतनानो संचार करे एवी अहंकृत आ वीरगाथा दस घंटमां विलक्षत छे. अंथनी प्रशस्तिनी कडीओ, अने वर्च्ये वर्च्ये, आलमां तारकियाना जेम, शोभी

\* जुओ, गोराशंकर हीराचंद ओजाकृत 'उदयपुर राज्यका इतिहास' अंड २, पृ० ४६५-४६६.

## ૨૬૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ અન્થ

જેડતાં કવિતોને આદ કરતાં ચૌપછિઓ અને દુહાઓની કડીઓની સંખ્યા ૬૨૦ છે. પોતાના રાષ્ટ્રના ગૌરવની કે પોતાની અરિમતાની રક્ષા માટે સર્વસ્વ ન્યોગાવર કરવાની પ્રેરણા આપતા આ વીરકાવ્યનું મૂલ્ય ચિરંતન છે. કવિવર હેમરતની આવી પ્રેરક અને બળકટ બાનીમાંથી થોડીક કાવ્યપ્રસાદી અહીં નીચે ૨૭૨ કરવામાં આવે છે :

### અંડ પહેલો

કથાના મુખ્ય વીરોનો નિર્દેશ કરતાં કવિ શરૂઆતના દુહામાં કહે છે :

સામિ-ધરમ નિષ્ઠુ સાચનિઃ, વીરા રસ સનિસેપ ।

સુભક્તા મહિ રીમા લહી, રાણી જિવદ્વાર દેખ ॥ ૬ ॥

ગોરા રાવત અતિ શુણુ, વાદલ અતિ બલનંત ।

બોલિસુ વાત બિહું તણ્ણ, સુષ્ણિયો સગદા સંત ॥ ૭ ॥

ચિત્રદૂટ (ચિતોડ)નું વર્ણન કરી કવિ રાજ રતનસેનનો પરિચય આપે છે :

તિષ્ણ ગઢિ રાજ કરછ ગહિલોત, રતનસેન રાજ જસ-નોત ।

પ્રથમ પરાક્રમ પૂર પ્રતાપ, પેસી ન સકદ જસુ ઘટિ પાય ॥ ૧૮ ॥

અવનિ ધર્મ લગ અવિચલ આણુ, બાલિ તપ્યું જસુ બારદ ભાણુ ।

વેરી કંદ તણું કુદાલ, રણ-રસીં નર્દ અતિ રંદાલ ॥ ૧૯ ॥

પરિનિની નારીનું સામાન્ય વર્ણન :

ભમર ધણ્ણા શુંબરથ કરણું, પદમિષુ-પરિમલ મોદા કિરણું ।

પદમિષુ તણું પર્તદર એહ, ભૂલા ભમર ન છણું દેહ ॥ ૮૭ ॥

### અંડ ફીલે

પરિણિનું દુહામાં વિરોધ વર્ણન :

વાદશ મહિ જિમ વીજલી, ચંચલ અતિ ચમકંતિ ।

મહુલ માહિ તિમ તે તણું, જલહલ તણુ જલકંતિ ॥ ૧૧૪ ॥

પાન પ્રહીસ્યદ્ય પદમિષુ, ગલિ તંબોલ ગિલ્લંતિ ।

નિરમલ તાનિ તંબોલ તે, દેહ મહિય દીસંતિ ॥ ૧૧૫ ॥

હંસ-ગમિષુ હેજણું હસણું, વદન-કમલ વિહસંતિ ।

દંતકુલી દીસધ નિસી, લાલિ કિ હીરા હુંતિ ॥ ૧૧૬ ॥

વ્યાસ રાધવચેતન; રાજનો કોપ; વ્યાસની વિચારણા :

તિષ્ણ ખુરિ રાધવચેતન વ્યાસ, વિદ્યાસું અધિકાર અવ્યાસ ।

રાજ તિષ્ણ રીજનીં વધું, સુહત વધું વધુ વ્યાસોં તાણું ॥ ૧૨૩ ॥

અક દિચસ્ત પદમિષુ નર્દ પાસિ, રાજ એઠણ કરછ વિદાસ ।

નેહ નિતંખની ચુંઅનિ કરણ, રાજ આલિંગન આચરણ ॥ ૧૨૪ ॥

તિષ્ણ પ્રસ્તાવણું રાધવ વ્યાસ, પુહતણ પદમિષુ તણું આવાસ ।

તે દેખી રાજ ઝુણુસીં, રાધવ કાપરિ કોપ જ ધણ ॥ ૧૨૫ ॥

વલતા ન્યાસ ન તેણા માંહિ, માંન સુહતથી સુંકથા ઢાંડિ ।  
ધણુ સુજ કીને પદમિષુ, આંખિ હુરાંનુ હું એ તણી ॥ ૧૩૪ ॥  
ન્યાસ સુષ્ણી ધમ ભનિ ઓહનઉ, કુણ વેસાસ કરણ સીહનઉ ।  
રાણ ભિન કદી નવિ હોઈ, નવિ હીકું નવિ સુષ્ણી કોઈ ॥ ૧૩૫ ॥

### અંડ નીઝે

રાધવની હિલ્લા તરફ રવાનગી; અલાઉદીનની કૃપા; પ્રતિપોધની પ્રતિજ્ઞા :

ધમ આલોચી રાધવ-ન્યાસ, ચિંચકોટ નહીં છેંડિઉ વાસ ।  
માણુસ સુહરદી લેછ કરા, ગદથી છાનઉ ગડ નીસરી ॥ ૧૩૭ ॥  
હિલ્લાપતિ પતિસાહ પ્રયંડ, અવનિ એક તસુ આણુ અખંડ ।  
અલાઉદીન નવ અંડે નામ, નૃપ મહુ તેણનથે કરણ સિદ્ધાંમ ॥ ૧૪૨ ॥  
માંન સુહત વધી પુર માંહિ, પૂછા તેણ નિત પતિસાહિ ।  
ઉલગતો દૂડઉ અવનીસ, પૂગી રાધવ તણી જગીસ ॥ ૧૪૩ ॥  
ધક દિન આવિજ એ અલભોન, “ રતનસેન સુજ મદી માંન ।  
વાલું વયર કિરી પરિ એહ, સાંભિ-ધરમ નધ હીથા છેહ ॥ ૧૪૪ ॥  
તઉ હું જઉ પદમિષુ અપહરું, ચિંચકોટથી અલગાઉ કરું ।  
પદમિષુ નારિ ખરી પદવા, લગી પતિસાહ કરું પરગાડ ॥ ૧૪૫ ॥

ચોથા અંડમાં પચિણીની શોધમાં અલાઉદીનનો સિંહલદીપનો ફેરો ક્રોગટ ગયાનું વર્ણન આવે છે.

### અંડ પાંચમો

અલાઉદીન રાધવને પચિણી ખીજે કુથાં છે એ પૂછે છે; રાધવ ચટવણી કરે છે;

અલાઉદીન ચિતોડ પર ચાંદી કરે છે :

“ સિંહલહીય પાંચ પદમિષુ, વલે કિંડા છધ કહિ સુજ લણી ” ।  
ન્યાસ કહેઠ — “ સંભલિ સુલિતાંણુ, છક વલિ પદમિષુનું અહિંડાંણુ ॥ ૨૩૫ ॥  
ચિંહુ દિસ ચિંહ ગઢ ચીતોડ, બીજાચસ મહિ વિસમધ ઢાંડ ।  
રતનસેન રાણ રંદાલ, કલહ કરે મહા ફંદાલ ॥ ૨૩૬ ॥  
તસુ ધરિ નારિ અછા પદમિષુ, સેધનાગ સિદ્ધિ જિમ હુધ મણી ।  
લેછ ન સકદ કોઈ તેહ, તિંબુ કારણું સું ભાણું એહ ॥ ૨૩૭ ॥  
સાહ કહેઠ — “ સંભલિ હા બંદ, એવડું ફોકટ ખાઉ આદંદ ।  
ણીજ વાત સહુ હિં તિજઉ, ગઢ ચીતોડ તણું સું ગજઉ ॥ ૨૩૮ ॥  
ઊમા-ઊલ કીડ પદમિષુ, ઊનિતા પકડું ગઢનઉ ધણી ” ।  
સખલ સેન લે આવિભ ચાંડ, ધર ધૂળ વાસિગ ધદહડિઉ ॥ ૨૩૯ ॥

### અંડ છૂટો

રતનસેનનો સામનો; અલાઉદીનની વિમાસણ અને છેતરપીડીની યોજના :

રતનસેન પિણુ શોસદી ચાંડ, દીકું આવિભ આવી ચાંડ ।  
સુખટ સેન સજ કીધી સહુ, બલવંત બોલદી બહસે બહુ ॥ ૨૪૭ ॥  
“ સાહિ બલદી તુ આવિજ સહી, પિણુ હિં નાનિ મ જાને વહી ।  
નાસંતો છધ નર નધ ઓડી, હું કાજુ હું ઈણુ હિંજ કોડી ” ॥ ૨૪૮ ॥

## ૨૬૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોલ્સવ અન્થ

સાંજ લગાઈ છૂટ સંગ્રહ, પિણ્ણ નવિ સીધાં કોઈ કાંચ ।  
ધણ્યા મરાવ્યા સુંગલ મીર, અસિપતિ માંની હીયાઈ હીર ॥ ૨૬૬ ॥

આલિમસાહિ કરાઈ આલોચ, લસકર માહિં છૂટ સંકોચ ।  
બાલ કહાઈ—“ સંભાળ સુખિતાંણ, તેટ ન કીયાઈ કિમ હી પ્રાણુ ॥ ૨૬૭ ॥

છાનાઉ કોઈ કરાઉ છલ-સેદ, મત પરનાસાઉ મરમ મજેદ ।  
વાત કરાવાઉ ક્રેચીં ઈસી, સાહિ છૂટ હિન તુમસું ઝુસી ॥ ૨૬૮ ॥

પદમિષુ હાથચી જમણુ તણી, તુઝ મનિ અંતિ અછાઈ અતિ ધણ્યી ।  
અનુર ન કાઈ માગાઈ સાહિ, અલાપ સેનસું આવાઈ માહિ ॥ ૨૭૧ ॥

એક વાર દેખી પદમિષુ, સાહિ સિધાવાઈ દીલી ભણ્યી ।  
—એમ કહી મેંકદા પરધ્યાંન, રતનસેન પૂજયા દે માંન ॥ ૨૭૨ ॥

“ કહુટ કિમ આલ્યા તુમિં પરધ્યાં ? ” તવ તે બોલાઈ—‘ સુણ્ણ રાંના ।  
આલિમસાહિ કહાઈ છદ છદ એમ,—“ માહો-માહિ કરાઉ હિન પ્રેમ ” ॥ ૨૭૩ ॥

### અંડ સાતમો

અલાઉદીનનું આગમન; પરિનીનો પીરસવાનો છનકાર; દાસીઓને જોઈને બાદશાહનું અચરજ :  
રાધવ વ્યાસ જાઉ મેતણું, રતનસેન નૃપ જાલણુ તણું ।  
નૃપ-મનિ કોઈ નહી છલ-સેદ ઝુરસાની મનિ અધિકાઉ એદ ॥ ૨૮૪ ॥

રતનસેન સરલાઉ મન માહિ, મની તેડણુ મેલયઉ સાહિ ।  
“ સાહિએ ! આજ પદારાઉ જાહિ ”, રતનસેન તેડાઈ ગહગહી ॥ ૨૮૫ ॥

રતનસેન હિન નિજ ધરિ ધણ્યી, બગતિ કરાવાઈ લોજન તણી ।  
પદમિષુ નારિ પ્રતાંચ જઈ કહાઈ—આલિમ મનિ હરબાધ અરાઉ ॥ ૨૮૬ ॥

લિખુ પરિ બોજન ભગતાઈ કરાઉ, જિમ આલિમ મનિ હરબાધ અરાઉ ” ।  
પદમિષુ નારિ કહાઈ—“ પ્રી ! સલ્લુઉ, નિજ કરિન કરિસું હું પ્રીમણું ॥ ૨૮૭ ॥

પદ રસ ભરસ કરે રસવતી, ગ્રીસેસી દાસી શુણુંતી ।  
સિંધુગારાઉ સંગાંઠી છોકરી, પાંતિ અછાઈ જાઉ તુમહ મનિ અરી ” ॥ ૨૮૮ ॥

તિહોં આવી એહો પતિસાહ, મન મહિ આવાઈ અધિક ઉછાહ ।  
પદમિષુ પાંહદ્યે અધિક પદૂર, દાસી આવી દિખાડાઈ નૂર ॥ ૨૮૯ ॥

ધક આવી બધસણુ દે જાઈ, ધીલ થાલ મેઢાવાઈ ઠાઈ ।  
નોલ આવી ધોવાદાઈ હાથ, ચોથી ટાકાઈ ચમર સનાથ ॥ ૨૯૦ ॥

દાસી આવાં ધમ જૂ જૂઈ, આલિમ મતિ અતિ વિહુનથ હુઈ ।  
“ પદમિષુ આ કદિ, આ પદમિષુ, જરિયી હી સર્ધ સહુ કામિષુ ” ॥ ૨૯૧ ॥

વ્યાસ કહાઈ—“ સંભાળ સુજ ધણ્યી ! એ સહુ દાસી પદમિષુતણી ।  
વાર-વાર સંયુ અબકાઉ એમ ? પદમિષુ ઈહાં પધારાઈ કેમ ? ” ॥ ૨૯૨ ॥

ઉચક હીસરી એ આવાસ, ધહોં છદ પદમિષુ તણું નિવાસ ।  
રતનસેન રાણ ધહોં રહાઈ, પદમિષુ નિરહ તિણું ઈક નવિ સહાઈ ॥ ૨૯૩ ॥

સામેના મહેદના ગોખમાં પરિનીને જોઈને બાદશાહ દેદો બની જય છે :

“ અહો અહો એ કહું પદમિષુ ? રંભ કહું, કદ કહું તુઅમિષુ ?  
નાગકુમદિ કદ કા કિનરી ? ઈદ્રાણી આંણી અપહરી ? ” ॥ ૨૯૪ ॥

રતનસેન પાદશાહને વળાવવા જતાં દગાથી ડેદ પકડાય છે :

“ કામકાજ કલો હમ ભણું, તુમ મહિમાની ક્રાંધી ધણું ।  
સીઅ હીઉ હિં ઉભા રહી ”, આલિમસાહ કહું ગણગાહી ॥ ૩૩૭ ॥  
ભૂપ ભણું—“ આધેરા ચલજ, જમ અમૃત જીવ હુધ અતિ ભલજ ” ।  
એમ કહી આધજ સંચારજ, ગઠથી બાહું નૃપ નીસરિજ ॥ ૩૩૮ ॥  
નૃપ મનિ કોધ નહી વલબેધ, યુરસાણું મન અધિકા ઘેથ ।  
ન્યાસ કહુધ—“ એ અવસર અરજાદ, ઈમ મ કહેજયો ન કાહું પણ્ધ ” ॥ ૩૩૯ ॥  
હલકાર્ય આલિમ અસપાર, માહો-માહિ મિલયા જૂઝાર;  
રતનસેન જાયજ તતકાલ, વિલક્ષી વાત હુદ્ધ વિસરાલ ॥ ૩૪૦ ॥

### અંડ આડભો

પ્રથાન દારા અલાઉદીનનો પદ્મિનીને સોંપીને રાજને છોડાવવાનો સંદેશો આવે છે :

“ હમકું નારિ દિયજ પદમિણું, જિમ હમ છાંદો ગઢનજ ધણું ॥ ૩૪૫ ॥  
નહી તરિ પ્રાણું લેશાં સહી, જઉ તુમહ ધણું પરિ દેશઉ નહીં ।  
જઉ તુમહ દેશઉ હમ પદમિણું, તઉ છૂટેસી ગઢનજ ધણું ॥ ૩૪૬ ॥  
નહી તરિ ગઢપતિ લીધજ ચહી, ગઢ પિણું હોવધ લેશાં સહી ।  
ગઢ લીધજ લીધી પદમિણું, હુદીજ અસપતિ કરસી ધણું ” ॥ ૩૪૭ ॥

પદ્મિનીનો ઓરમાન પુત્ર વીરભાણ અને ખીજન સુભટો પદ્મિનીને અલાઉદીનને  
સોંપી દેવા તૈયાર થાય છે :

વીરભાણ પિણું પદમિણું દિસી, દેતો હોવધ મન મહિ ખુરી ।  
“ ધાણું સુચ માત તખું સોહાગ, લેઈ દીધજ દુખ દઉહાગ ॥ ૩૪૩ ॥  
તિણું કારણું દેતો પદમિની, વલિ સુચ માત હુધ સામિની ”  
વીરભાણ સમલની કહુધ—“ પદમિણું દીધજ સથણું રહ્ય ” ॥ ૩૪૪ ॥  
સગદે સુભટે થાપી વાત—“ પદમિણું દેશાં હિં પરભાતિ ”  
હમ આલોચી ઊરાય નિસધ, પદમિણું સહુ સાંભવીજ તિસધ ॥ ૩૪૫ ॥

પદ્મિનીની વિમાસણું; ગોરા પાસે ગમન; ગોરાનું આશાસન :

પદમિણું હેઠ હીધ ખલખલી, “ વાત ખુરી મહું એ સાંભલી ।  
અંડુ લુબ ! દહું નિજ દેહ ! પિણું નનિ નહીં અસુરાં ગેહ ॥ ૩૪૭ ॥  
રાન ધાણું પરિ બંધે હીજ, વાંસદ એ આલોચહ કીજ ।  
સગદા સુભટ હૂંઆ સતહીણું ! હિં કિણું આગાલ ભાણું હીણું ॥ ૩૪૮ ॥  
બખત દસહ સુચ આવિજ વહી, સરણુાધ કો દેખું નહીં ।  
હિં જગહીસ ! કરીજધ કિસું ? દેખજ સંકટ આવિજું ધસું ॥ ૩૪૯ ॥  
દે જીજ ! તું નનિ બાંધે હીણું, જીજ ! મ હાયો દે સતહીણું ।  
મરતાં સહુવધ સમરધ સરી, હિં-સુચ કર્મ કિયા હોધ મહી ” ॥ ૩૫૦ ॥  
હિં ચિયા ચિયા ચિયા ચિયા—“ ગોરા-ખાદલ બેહી શુણું ।  
યાંસું લધ કરું લીનતી, થીનું માહિ ન દીસધ રતી ” ॥ ૩૫૧ ॥  
ઈમ આલોચી પદમિણું નારિ, ચહી ચકરોલિ પહુંતી થારિ ।  
સાથધ લેધ જાખી પરિવાર, આપી ગોરિલારધ દરબારિ ॥ ૩૫૨ ॥

ગોરાનો વિરોચિત જવાબ :

ગોરઉ સાંમાં ધાયો ધસી, વિનય કેરી ધમ બોકાઈ હસી ।  
 “ ભાત ! ભયા બજુ કોથી આજ, કહુ પધાર્યા કેહદ કાજ ॥ ૩૮૬ ॥  
 આકાશાં માર્છિ આવી ગંગા, પદમિષું હુએ સુજ અંગણુ-અંગ ” ।  
 વદતી બોકાઈ ધમ પદમિષું, “ હું આવી હુમહ મલવા ભણી ॥ ૩૮૭ ॥  
 સુલટે સગલે હીધી સીખ, દયા ધરમની લીધી હીઅ ।  
 સીખ દિલ હિંબ તુર્ગદ પિણુસલી, જિમ અસુરો ધરિ જાઉ વહી ॥ ૩૮૮ ॥  
 સુલટ સહૂ હૂએ સત હીણ, જિતિ-પુરિ જિતવઠ હૂદ્ધ ખીણ ।  
 સુલટે સગલે દાખિઉ દાઉ, પદમિષું હે નદી લેશાં રાઉ ॥ ૩૮૯ ॥  
 હિંબ તુર્ગ સીખ દિલ છઉ કિસી ? સુલટે સગલે કોથી ધસી ”  
 ગોરઉ જંપદ—“ સુણુ સુજ ભાત ! ગઢ માહે હું કેળી આન ! ॥ ૩૯૦ ॥  
 અરચન ન આવ્યા રાજ તણું, પૂછદ કોઇ નહી મંત્રણું ।  
 પિણુ મન આરતિ મ કરઉ ભાત ! ભક્તી હુસી હિંબ સગલી વાત ॥ ૩૯૧ ॥  
 જધ તુર્ગિ આવ્યા સુજ ધરિ વહી, તઉ અસુરો ધરિ જાણ નહી ।  
 સુલટ તણું એ નહી સંકેત, આંગી દેંધ નદી લીજાદ જેત ॥ ૩૯૨ ॥  
 પદમિષુ જંપદ—“ ગોરા ! સુણુ, ધિણુ ધરિ છાજાદ એ મંત્રણું ।  
 સિરિઅધ-સિરિઅડ સગલે થાઈ, લીત પણે નવી ચિત્ર લિખાઈ ” ॥ ૩૯૪ ॥

બાહલની ગર્જના :

ગોરઉ જંપદ—“ સુણુ સુજ ભાઈ ! ગાજણુ હુંતઉ સુજ વદ ભાઈ ।  
 તસુ સુન બાદદા અતિ બલવંત, તેહ નદી પિણુ નાં પૂછું મંત ” ॥ ૩૯૫ ॥  
 એહી આયા બાદિલ દિસી, બાદિલ સાંગહો ધાયઉ ધસી ।  
 વિનયરંત પગ કરીય પ્રખૂઅમ, પૂછદ બાદિલ—“ કેહઉ કાન ? ” ॥ ૩૯૬ ॥  
 ગોરઉ જંપદ—“ બાદિલ સુણું, સુલટે કોધઉ એ મંત્રણું ।  
 પદમિષુ દેંધ નદી લેશાં રાય ! અવર ન મંદદ કોઇ ઉપાય ॥ ૪૦૦ ॥  
 પદમિષુ આવી આપ્યા પાસ્યિ, હિંબ તઉ કાસું કહી વિમાસી ।  
 તાનાદ પૂછણું આયા સહી, કરશાં વાત તુહારી કહી ” ॥ ૪૦૧ ॥  
 પદમિષુ બાદિલરું વધિ ભાણુધ—“ સરણુધ આવી હું હુમહ તણુધ ।  
 રાખી સકું તઉ રાખઉ સહી, નહી તદ્દિ પાછી જાઉ વહી ॥ ૪૦૨ ॥  
 અંડુ જી દંનું નિજ દેહ, પિણુ નવિ જાઉ અસુરો ગેહ ।  
 કાયા જમહર કરિ નદી બંનું, પિણુ નવિ કોઇ થકી નાકલું ” ॥ ૪૦૩ ॥

હુંણ

ધમ સુણુ બાદિલ બોલીઉ, હું મહા ફરદંત ।  
 નાંખુ કિ ગયથર ગાળું, અતુલ બદી એકેતન ॥ ૪૦૪ ॥  
 “ સુણુ બાબા ! ” બાદિલ કહીદ, “ સુભદ્રાંસું કુણ કાંમ ? ”  
 સુલટ સહૂ સૂંઘે રહું, એ કરિસદું હું કાંમ ॥ ૪૦૫ ॥  
 કાકા એ કાંચ બલબલઉ, અંગિ મ ધરુ ઉતાપ ।  
 તઉ હું બાદિલ તાહરઉ, સયલ હંડ સંતાપ ॥ ૪૦૬ ॥

પદમિષુ અંગળું પગ હીજ, પચિન હું સુજ ગેહ |  
 મહાલિ પધારજ માડલી, હુઅ જ ધરજ નિજ દેહિ || ૪૨૦ ||  
 આદિમ બાંજું એકલાઉ, જજ વાંસઈ જગદીસ |  
 તડ હું આદિલ બહરોઉ, જજ આણું આવનીસ ” || ૪૨૧ ||

### અંડ નવમા

બાદલની ભાતા અને પત્તી બાદલના યુદ્ધે ચયવાના સમાચારથી ચિંતિત થઈ ને એને યુદ્ધે  
 ન ચડવા સમજવે છે. પણ દટ્ટનિશ્ચથી બાદલ છેવટે પોતાની પત્તીને સમજાવી લે છે, અને  
 યુદ્ધે ચયવા સજજ થાય છે. પછી પોતાનો જીવ ખચાવવા દૃષ્ટાતા સુભટેને એ સમજવે છે :

“ કાયા-માયા એ કારિમી, ઘડી એક વાંદી ઘડી એક સમી |  
 કાયર હું અથવા હું સ્ફુર, મરણું કિંબુધીથી ન ટકાઈ હુર || ૪૨૨ ||  
 તજ તે મરણું સમારી મરજ, ટાંડા હોઈ કિસું ઉંગરજી |  
 ‘પદમિષુ દીધી’ કાહીએ કેમ, પતિ રાખણું જજ છધ પેમ ” || ૪૨૩ ||

વીરભાણુ અને બાદલ વચ્ચે વાતચીત; બાદલની રવાનગી :

વીરભાણુ ધિમ નિસુધી ભાણુધ—“ બાદિલ ! બોલિઓ તું અલિ ઘણુધી |  
 ભાષી સહૂ ભલી તરું વાત, પિણુ નવિ પ્રીણધ તું તિલ ભાન || ૪૨૪ ||  
 આદિમ ઈસ તખું અવતાર, લસકર લાખ જતાનીસ લાર |  
 યતની સુભટ વડા ઝૂઝાર, હણુધ છેકીકું હેલિ હળાર || ૪૨૫ ||  
 સાહી લીધાઈ વલિ સિરદાર, ઝૂંંતા આનાધ તસુ ભાર |  
 કોઈ પરિ હિંબ હુદાય નહી, નહિ તરિ મહે વલિ ઝૂંંત સહી ” || ૪૨૬ ||  
 બાદિલ બોલધ—“ કુંઅર સુખું, એ આદોચ નહી આપણું |  
 કિસા આદોચ કરદ્ય કેસરી ? મારદ્ય ભયગલ માથધ ધરી ” || ૪૨૭ ||  
 વીરભાણુ હિંબ બોલધ વડી—“ બાદિલ ! તું મતિ અતિનિરભલી |  
 અરજુલું તે જે વાલધ ગાધ, કદ્ય જિમ હિંબ તું આવધ દાધ || ૪૨૮ ||  
 રાન ધૂરધ પદમિષુ રહદ્ય, ધિષુ વાતાઈ કુણ નવિ ગહગહુધ ” |  
 બાદિલ બોલધ—“ કુંઅર ! સુખું ! કર્યો ઊપર વાંસઈ ધાણું ” || ૪૨૯ ||  
 હું જજ હું લસકર માહિ, આણું વાત સહૂ અખગાહિ ” |  
 અર જુહાર બાદિલ અસ ચર્દિઓ, સાહસ સુરપતિ સાંસઈ પાદું || ૪૩૦ ||

### અંડ દસમો

જેમ અલાઉદીને પ્રપંચ રચીને રતનસેનને ડેદ પડખો હતો તે રીતે બાદલ અલાઉદીને હળીને  
 રતનસેનને છોડાવવાની યોજના ધરે છે. તે બાદશાહ પાસે જર્દને એને કહે છે કે તમને મહેલમાં  
 જેયા ત્યારથી પદ્ધિની તો તમારા ઉપર આસક્ત થઈ છે. તમે કહો તો એની એ હજાર દાસીઓના  
 રસાલા સાથે એને અહીં લઈ આવું. કામાંધ બાદશાહ કંબૂલ થાય છે, અને બાદલને કીમતી લેઠો  
 આપીને એનું બહુમાન કરે છે. બાદલ આવીને વીરભાણુને અને સૌને બધી વાત કહે છે અને પોતાની  
 યોજના સમજવે છે. પછી એ હજાર પાલભીઓમાં દરેકમાં એ-એ સુભગોને અને પદ્ધિનીની પાલભીમાં  
 ગોરા રાવતને બેસાડી બાદલ એ બધું લઈ ને બાદશાહની છાવણીમાં જાય છે; બાદશાહને સમજાવી એના  
 લશકરને આધું મોકલાવી હે છે અને સિકલથી રતનસેનને છોડાવી ગઢમાં મોકલી હે છે. રતનસેન સંકુશલ

## ૩૦૨ : શ્રી મહાવીર કેન વિદ્યાલય સુવર્ણમહોસુવ અન્થ

ગુરમાં પહોંચી ગયાનો દોલ-વાળનો અગ્રાજ સાંભળીને પાલભીઓમાંના સુલારો બાદશાહની ખાવણી ઉપર તૂટી પડે છે. લશકરને મોખ્રે ગોરા અને બાહ્લ છે. બાદશાહને પડકાર કરવામાં આવે છે :

“ રે ! રે ! આચિત્ન જીબણ રહે, હિન નાસી મત લધ વહે ।  
પદમિષુ આણુ છું અનિહ જિડા, તોનધ હિબદ હિખાંન તિડા ” ॥ ૫૮૩ ॥

પછી તો અલાઉદીનનું લશકર આવી ચું છે અને ખૂનભાર જંગ જમે છે. ત્યારે અલાઉદીન કહે છે :

“ રે ! રે ! કૂદ શુજ બાદિલાઈ, આવજ સુલાર સંદુ હિબ કિલાઈ ” ।  
હુલકાર્ય અસપતિ નિજ લેધ, ધાય કિલાદી કરતો કોધ ॥ ૫૮૪ ॥

યુદ્ધમાં ગોરાનું પરાક્રમ; રાજન-રાણીનું યુદ્ધ-દર્શન; ગોરાની વીરગતિ :  
સૂર્યન નિજ રથ અંચી રહેઠ, દગતિ-વિગતિ નવિ કંઈ લહેઠ ।  
ધિષુ અવસરિ જોરડ ગજગાહિ, ધાઈ આચિત્ન જિહું પતિસાહ ॥ ૫૮૫ ॥  
મેદાણ અણ મહાબલિ જિસૈં, અસપતિ અલગણ નાઠિ તિસૈં ।  
ખોલાદ બાદિલ એ કર જેઠ, “ નાસંતો માયેં છું ઓઠ ” ॥ ૫૮૬ ॥  
રતનસેન રાજ અતિ લક્ષણ, ગઢ જીપરથી દે ખદ કિલાઈ ।  
લેવધ બાદિલ ગોરા તણું, હાથ મહાબલ અદિગંજાણું ॥ ૫૮૭ ॥  
પદમિષુ જીબી ઘદ આસીસ, “ જુબે બાદિલ કોઈ વરીસ ।  
ધન્ય ધન્ય અલિહારી દૃજ, તથ શુજ રાખિણ સંગણુ ગૃજ ॥ ૫૮૮ ॥  
સુલાર ધણુા છદ્ધ જીબા એહ, તે સગલાં નીસત નિસનેહ ।  
બાદિલ એક મહાબલ સહી, સત્ય થકી એ ચૂકદ નહીં ॥ ૫૮૯ ॥  
સૌંભિ-ધરમ સાચણ સસનેહ, રાખી બાદિલ રણુષટ રેહ ” ।  
ગોરડ રાખત રણુમહિ રહિઉ, આવમ-સેન સંદુ લણુ બહિઉ ॥ ૫૯૦ ॥

વિજય; બાહ્લને વધામણાં :

જયાયકાર હુણ જસ લીધ, કરણું બાદિલ અધિકી શીધ ।  
જીધિયા ગદના બારણુા, બિરદ હુણા આદિલનધ ધણુા ॥ ૫૦૨ ॥  
રાજ સૌંઘણ આચિત્ન રંભ, મિલયા એહી અગોચરિ ।  
મહામહોછળિ માહે લીઉ, અરથ દેસ બાદિલ નધ દીઉ ॥ ૫૦૩ ॥

બાહ્લની માતા અને પતની એતનું સ્વાગત કરે છે; ગોરાની પતની સતી થાય છે;  
છેદની એ કદીઓમાં કવિ જાળે કથાનો સાર કહે છે :

બિરદ છુલાવધ બાદિલ ધણુા, સૌંભિ-ધરમ સત્વંતો તણુા ।  
ધસણ ન કોઈ હુણ સૂર, નિહું લખણુ શાધણ જસપુર ॥ ૫૯૬ ॥  
પદમિષુ રાખી રાજ લીઉ, ગદનઉ ભાર ધણુઉ અલીઉ ।  
રણુષટ કરીનધ રાખી રેહ, નમો નમો બાદિલ શુણુ-ગોહ ॥ ૫૯૦ ॥ \*

નોંધપુર તા. ૧૭-૧૨-૬૬

\* આ ચૌપદીની એ કદીઓ ઉપર આપવામાં આવી છે તે પહેલાં ઉપલખ્ય ધેયેલી પ્રતને આધારે તૈયાર કરેલ નકલમાંથી લેવામાં આવી છે. આ પછી, કેટલાક વખત પહેલાં, કવિ હેમરતનાના પોતાના હાથે લખાયેલી આ ચૌપદીની હસ્તપત્ર મળી આવી છે અને અત્યારે હું એતનું સંપાદન કરી રહ્યો હું, કે રાજરથાન માચ્યનિધા મલિશાનાની અન્થમાળામાં ૪૦મા અન્યાંકે તરીકે મગટ થશે.